

ત્વરિત જાહેરાત માટે

બ્રેમ્પટન જારી કરે છે અઘતન કરેલ પર્યાવરણ માસ્ટર પ્લાન

*પ્લાનમાં હશે બ્રેમ્પટન માટે ટકાઉપણા અને હવામાન પરિવર્તન
અંગેની આશરે 60 ઉચ્ચ-પ્રભાવ ક્રિયાઓ.*

બ્રેમ્પટન, ઓન્ટારિયો (25 માર્ચ 2021) – માર્ચ 24ના રોજ, બ્રેમ્પટન સીટી કાઉન્સિલે સર્વાનુમતે [ગ્રીન સિટી](#) બનવાની પોતાની પ્રતિબદ્ધતાના જવાબરૂપે [બ્રેમ્પટન ગો ગ્રીન ઇન્વાયરન્મેન્ટલ માસ્ટર પ્લાન \(EMP\)](#), અઘતન કરવાની મંજૂરી આપી હતી..

આ મધ્યવર્તી દસ્તાવેજને અઘતન કરવું સીટી ઓફ બ્રેમ્પટનની પર્યાવરણીય સફળતાઓને ભારપૂર્વક દર્શાવે છે કે કેવી રીતે પર્યાવરણીય અગ્રીમતાઓ 2014માં પ્રથમ વખત જારી થયેલ EMP થી અત્યાર સુધીમાં તેનો વિકાસ થયો, અને તેનાથી ફરી તાજો થયેલ એક્શન પ્લાન આ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે પૂરો પડાશે. એક્શન પ્લાનમાં 60 ઉચ્ચ પ્રભાવ ધરાવતી ક્રિયાઓ સમાયેલ છે જે આગામી દાયકામાં શહેરને વધુ હરિત બનાવવાનો માર્ગ દર્શાવે છે અને બ્રેમ્પટનના સમાજને નિરોગી, સ્થિતિસ્થાપક અને પર્યાવરણીય રીતે ટકાઉ બનવા માટે ગતિ પ્રદાન કરશે.

આ ક્રિયાઓમાં સામેલ છે કમ્યુનિટી ગાર્ડન્સ પ્રોગ્રામ, જે બી સિટી (Bee City) તરીકે નિયુક્ત થવાનું લક્ષ્ય સેવે છે, ક્લાઈમેટ ચેન્જ અડેપ્ટેશન પ્લાન પ્રસ્થાપિત કરવો, અને સિટીની ફેસિલિટીઓ માટે જલ કાર્યક્ષમતાની વ્યુહરચનાઓનું સર્જન કરવું.

જે પાયારૂપ કાર્ય થઈ જ રહ્યું છે તેના જવાબરૂપે સિટી અને તેમના ભાગીદારો નિવાસીઓને શિક્ષિત અને રોમાંચિત કરવાનું ચાલુ રાખશે તેમજ રહેવાસીઓ, વ્યવસાયો અને સામાજિક સંગઠનોનું સશક્તિકરણ કરશે જેથી તેઓ હવામાન પરિવર્તન અને પર્યાવરણીય ટકાઉક્ષમતા પર પગલાં લઈ શકે.

પૃષ્ઠભૂ

આખા સમાજ ફરતે પર્યાવરણીય ટકાઉક્ષમતા આંતરિક રીતે સુધારવા માટે બ્રેમ્પટન ગો ગ્રીન EMP સિટીની ભાવિ યોજના છે. EMP જે પ્રથમ વખત 2014માં જારી થયું તે દૂરદ્રષ્ટિ, માર્ગદર્શક સિદ્ધાંતો, ધ્યેયો અને વધુ ટકાઉ ભવિષ્ય માટેની ક્રિયાઓ અને પ્રગતિનું વહન કરવા અને મૂલવવા માટે કામગીરીના મેટ્રિક્સ અને લક્ષ્યોની રૂપરેખા આપે છે.

EMP સિટીની અનેક યોજનાઓ, નીતિઓ, પરિયોજનાઓ અને પ્રાણાલિઓ માટે ઉન્પ્રેરક પુરવાર થયું છે જે બ્રેમ્પટનની પર્યાવરણીય કામગીરીને, જીવન ગુણવત્તાને સુધારી રહ્યું છે અને ગ્રેટર ટોરોન્ટો તેમજ હેમિલ્ટન ક્ષેત્રમાં સિટીને પર્યાવરણીય અગ્રણી તરીકે સ્થાપિત કરવામાં મદદરૂપ રહ્યું છે.

સુવાક્યો

"બ્રેમ્પટન સીટી કાઉન્સિલે સર્વાનુમતે નવો બ્રેમ્પટન ગો ગ્રીન એન્વાયરોમેન્ટલ માસ્ટર પ્લાનને મંજૂરી આપી છે. બ્રેમ્પટન એક હરિત શહેર છે અને અમે તે સુનિશ્ચિત કરવા સમર્પિત છીએ કે અમે જે પણ કરીશું તેમાં ટર્મ ઓફ સિટી કાઉન્સિલ પ્રાયોરિટી પ્રતિબિંબિત થાય. અદ્યતન કરેલ પ્લાન એક ચાવીરૂપ દસ્તાવેજ છે જે વ્યુહાત્મક રીતે આગામી દાયકામાં બ્રેમ્પટનમાં ટકાઉક્ષમતાને આગળ ધપાવશે."

- પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"નવા બ્રેમ્પટન ગો ગ્રીન એન્વાયરોમેન્ટલ માસ્ટર પ્લાનને મંજૂરી આપતા અમને ગૌરવની લાગણી થાય છે. બ્રેમ્પટન માટે વધુ ટકાઉ ભવિષ્ય સુનિશ્ચિત કરવા માટેની આ એક ક્રિયાલક્ષી યોજના છે જેના 60 ઉચ્ચ પ્રભાવ ધરાવતા મુદ્દાઓમાં કોર્પોરેટ (સિટી) અને સામાજિક અવલોકનની બારી સમાયેલી છે. હું આ નવા પ્લાનનું અન્વેષણ કરવા બધાંને નિમંત્રિત કરું છું."

- પૉલ વિસેન્ટ, પ્રમુખ, પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ; રિજનલ કાઉન્સિલર, વૉર્ડ 1 અને 5, સિટી ઓફ બ્રેમ્પટન

"2050 સુધીમાં અમે બ્રેમ્પટનમાં ગ્રીનહાઉસ ઈમેશનનો 80 ટકા જેટલા ઘટાદવાના માર્ગે છીએ અને અદ્યતન કરેલ બ્રેમ્પટન ગો ગ્રીન એન્વાયરોમેન્ટલ માસ્ટર પ્લાન આ ધ્યેયને મદદરૂપ થશે. સમાજમાં વાસ્તવિક પરિવર્તન આણવા અને વધુ સારું ભવિષ્ય બનાવવા માટે અમારી પાસે પ્રભાવી યોજનાઓ છે."

- ડુગ વ્હિલ્હાન્સ, સિટી કાઉન્સિલર, વૉર્ડ 2 અને 6, સભ્ય, એનવાયર્નમેન્ટ એડવાયઝરી કમિટી; સભ્ય, CEERP કમ્યુનિટી ટાસ્ક ફોર્સ, સિટી ઓફ બ્રેમ્પટન

"અદ્યતન કરેલ બ્રેમ્પટન ગો ગ્રીન એન્વાયરોમેન્ટલ માસ્ટર પ્લાન મારફતે સિટીના કર્મચારીઓ ટકાઉ પરિવર્તન લાવવા સમર્પિત છે. આ મહત્વના એક્શન પ્લાનનો અમલ કરવા માટે અમે અમારા ભાગીદારો અને હિસ્સાધારકો સાથે મળીને કાર્ય કરવાનું ચાલું રાખીશું."

- ડેવિડ બારિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રેમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 7,00,000 કરતા વધુ લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca